

3rd Joint Working Group Meeting between India and Japan on MoC on Specified Skilled Workers

નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારો પર સહકારની સમજૂતિ પર ભારત અને જાપાન વચ્ચે 3જી સંયુક્ત કાર્યકારી જૂથની મીટિંગ

03 ઓગસ્ટ, 2022

ભારત અને જાપાન દ્વારા 2 ઓગસ્ટ 2022 નાં રોજ નવી દલ્હીમાં નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારો પર હાઈબ્રિડ ફોર્મેટમાં 3જી સંયુક્ત કાર્યકારી જૂથની મીટિંગ યોજવામાં આવી હતી. ભારતીય પ્રતનિધિ મંડળની આગેવાની વલ્લિશ મંત્રાલયનાં સંયુક્ત સચિવ (OIA-I) શ્રી અનુરાગ ભુષણ અને કૌશલ્ય વકાસ અને ઉદ્યોગ સાહસકિતા મંત્રાલયનાં સંયુક્ત સચિવ ડૉ. કે. કે. દ્વિવેદી દ્વારા કરવામાં આવી હતી, અને તેમાં રાષ્ટ્રરચિ કૌશલ્ય વકાસ કોર્પોરેશનનાં પ્રતનિધિઓનો સમાવેશ થતો હતો. જાપાનીઝ પ્રતનિધિ મંડળની આગેવાની ઈમગિરેશન સર્વિસ એજન્સીનાં સહાયક નાયબ મંત્રી શ્રીમાન નાકાગાવા સુટોમુ દ્વારા કરવામાં આવી હતી, અને તેમાં વલ્લિશ મંત્રાલય, આરોગ્ય, શરમ અને સુખાકારી મંત્રાલય, કૃષિ, વન અને મત્સ્યોદ્યોગ મંત્રાલય, અને જાપાન ટુરઝિમ એજન્સીનાં પ્રતનિધિઓનો સમાવેશ થતો હતો. સંબંધિત દૂતાવાસનાં અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

2. કરારનાં આધાર પર રોજગારી માટે ભારત થી જાપાન જવા માટેની કૌશલ્ય અને જાપાનીઝ ભાષાની પૂરતી કરતા કૌશલ્ય ધરાવતા કામદારોનાં આવાગમનનો પ્રચાર કરવા માટે ભારત અને જાપાન દ્વારા જાન્યુઆરી 2021 માં નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારો પર સહકારની સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

3. આ સંયુક્ત કાર્યકારી જૂથની મીટિંગ દરમિયાન, બન્ને પક્ષોએ નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારો અંતરગત ભારત અને જાપાન વચ્ચે પ્રવર્તમાન સહકારની સમીક્ષા કરી હતી અને સંમત થયા હતા કે ભારત થી જાપાન તરફ નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારોની સંખ્યાને વેગ આપવાની નોંધપાત્ર સંભાવના રહેલી છે. આ સંદર્ભમાં, તેઓએ પ્રવર્તમાન યંત્રણામાં રહેલા પડકારોની ઓળખ કરીને અને આગળનાં માર્ગ પર દ્રષ્ટિકોણોનું આદાનપ્રદાન કરીને નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારોનાં પ્રોગ્રામનાં અમલીકરણમાં વધારે સુધારો કરવા માટેનાં માર્ગો પર ચર્ચાઓ યોજી હતી. આ મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવેલા મહત્વનાં મુદ્દાઓમાં ડિડિલિ ટેકનોલોજી અને મંચોનાં ઉપયોગ સહિત માંગ-પૂરવઠા મેચ કરવા, ભારતમાં કસોટી કેન્દ્રોની સંખ્યા વધારવી, અમલીકરણનાં ક્ષેત્રો વધારવા, ભારતમાં નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારોનાં પ્રોગ્રામ વલ્લિ જાગૃતિ વધારવી, ભારતમાં જાપાનીઝ ભાષાનાં પ્રચાર, અને દેખરેખ કરતા પ્રોગ્રામ માટે ફરેમવરકની સ્થાપના કરવાનો સમાવેશ થતો હતો. જાપાનીઝ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નર્સીંગ/સંભાળ-આપવા અંતરગત પ્રવર્તમાન સહકાર ઉપરાંત, નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારોનું વસિતરણ ભારતમાં કૃષિ ક્ષેત્રને પણ આવરી લેશે. ભારતીય પક્ષ દ્વારા આ જાહેરાતનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અન્ય ક્ષેત્રોમાં પણ નરિદ્ધિ કૌશલ્ય ધરાવતા કામદારોનાં વસિતરણ માટે આહ્વાન કર્યું હતું.

4. બન્ને પક્ષો નજીકનાં ભવિષ્યમાં પરસ્પર સાનુકૂળ સમય પર આગામી સંયુક્ત કાર્યકારી જૂથની મીટિંગ યોજવા સંમત થયા હતા.

નવી દિલ્હી

03 ઓગસ્ટ, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.